

B.Com. Semester - 5 (CBCS) Examination
Oct/Nov - 2022 (NEW COURSE)
Indirect Tax Law - 1(Dse-3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	GST શું છે? ભારતમાં GST શા માટે જરૂરી છે?	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૧	(a) GST ના ફાયદા સમજાવો.	(૧૦)
	(b) પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર વચ્ચેનો તફાવત	(૧૦)
પ્રશ્ન.૨	કઈ પ્રવૃત્તિઓને માલસામાનના પુરવઠા અથવા સેવાઓના પુરવઠા તરીકે ગણવામાં આવે છે?	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૨	(a) GST હેઠળ સપ્લાયનો ખ્યાલ સમજાવો.	(૧૦)
	(b) "વિચારણા વિના પુરવઠો" સમજાવો.	(૧૦)
પ્રશ્ન.૩	સેવાઓના પુરવઠાનો સમય કેવી રીતે નક્કી કરવો?	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૩	રિવર્સ (પાછળ) ચાર્જ હેઠળ માલના પુરવઠાનો સમય સમજાવો	
પ્રશ્ન.૪	સપ્લાયના મૂલ્ય એટલે શું? વ્યવહાર મૂલ્યમાં કઈ વસ્તુઓ શામેલ છે?	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૪	સપ્લાયના મૂલ્ય હેઠળ નાણાં, વ્યક્તિ અને એજન્ટ શબ્દ સમજાવો.	

ENGLISH VERSION

Q.1	What is GST? Why GST is required in India?	(20)
	OR	
Q.1	(a) Explain the benefits of GST.	(10)
	(b) Difference between Direct Tax and Indirect Tax.	(10)
Q.2	Which are the activities to be treated as supply of goods or supply of services?	(20)
	OR	
Q.2	(a) Explain the concept of supply under GST.	(10)
	(b) Explain "Supply without consideration".	(10)
Q.3	How to ascertain the time of supply of services?	(15)
	OR	
Q.3	Explain the Time of supply for goods under reverse charge	
Q.4	What is meant by value of supply? What items are included in transaction value?	(15)
	OR	
Q.4	Explain the term Money, Person and Agent under value of supply.	